

سُورَةُ الْوَاقِعَةِ مَكِّيَّةٌ

(۵۶)

અલ - વાકેઆહ

૧. અલ્લાહના નામથી; જે બેહદ કૃપાળુ અને ① بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
દયાવંત છે.

૨. જ્યારે તે સમય^(૧) આવી પહોંચશે, ત્યારે.

૩. તેના આગમનને કોઈ ખાટું નહિ કરાવી શકે.

૪. જે કેટલાકને ઊતારી પાડશે અને કેટલાકને બૂલંદી આપવશે.

૫. તે દિવસે પૃથ્વીને^(૨) હચમચાવી દેવામાં આવશે,

૬. અને પર્વતોના ભૂકે ભૂકા ઊડાવી દેવામાં આવશે.

૭. તેની બારીક રજકણો બની હવામાં ઊડી જશે,

૮. અને તમે (તે સમયે) ત્રણ વર્ગોમાં વહેંચાઈ જશો.

૯. (પહેલા) જમણા તરફના લોકો છે, તે કેવા ② إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ①
(નસીબદાર) છે, તે જમણી તરફવાળા.

૧૦. (બીજા) ડાબી તરફના છે, કેટલા ③ لَيْسَ لَوْفَعَتِهَا كَاذِبَةٌ ②
બદનસીબ^(૩) છે તે ડાબી તરફવાળા.

૧૧. (ત્રીજા નેકીઓમાં) આગળ નીકળી ગયેલા છે, તે સૌથી આગળ નીકળી ગયા છે;^(૪)

૧૨. તેમણે (અલ્લાહની) નજદિકી પ્રાપ્ત કરી હશે.

૧૩. તેઓ ને'મતોવાળી જન્નતોમાં હશે—

૧૪. જેમાંનો મોટો ભાગ પહેલીવારમાંજ ઈમાન લાવનારાઓનો હશે,

④ خَافِضَةٌ رَافِعَةٌ ③
⑤ إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًا ④
⑥ وَبُسَّتِ الْجِبَالُ بَسًّا ⑤
⑦ فَكَانَتْ هَبَاءً مُنْبَثًّا ⑥

⑧ وَكُنْتُمْ أَزْوَاجًا ثَلَاثًا ⑦

⑨ فَاصْحَبُ الْيَمِينَةِ ⑧ مَا أَصْحَبُ الْيَمِينَةِ ⑨

⑩ وَأَصْحَبُ الشِّمَالِ ⑨ مَا أَصْحَبُ الشِّمَالِ ⑩

⑪ وَالشِّفُّونَ السِّقُّونَ ⑩

⑫ أُولَئِكَ الْمُقَرَّبُونَ ⑪

⑬ فِي جَنَّاتٍ النَّعِيمِ ⑫

⑭ ثَلَاثَةٌ مِنَ الْأَوَّلِينَ ⑬

૧. ક્યાતમનો દિવસ અવશ્ય આવીનેજ રહેશે.

૨. મુસ્લિમો તથા કાફરો વચ્ચેનો જે સમયે ફેસલો કરવામાં આવશે તે ઘડી અટલ છે, ત્યારે ભલાઈ કરનારાઓ ભલો બદલો પામશે અને બૂરાઈ કરવારાઓનું પતન થશે.

૩. પોતાની શહેવત (વિષય વાસના)ની ગુલામીમાં જકડાયેલા જીવો.

૪. સદાચારોમાં પરિશ્રમ કરનારાઓની રૂહો સંતુષ્ટ હશે અને નજાત (મોક્ષ) પામશે.

૧૫. અને બાદમાં (ઈમાન લાવનારાઓમાંના) થોડાંકજ હશે,
 ૧૬. તેઓ (સુવર્ણ તથા રત્નજડિત) આસનો ઉપર,
 ૧૭. સામ સામે અઢેલીને બેઠા હશે.
 ૧૮. તેમની તહેનાતમાં અમર જુવાની પામેલા યુવકો હાજર રહેશે,
 ૧૯. તેમના હાથમાં ઝરણામાંથી ભરેલાં (નિર્મળ) પીણાની સુરાહીઓ અને પ્યાલા હશે.
 ૨૦. જેના (પીવા)થી ન તો તેમનું માથું ભમશે ન તેમને નશો ચડશે.
 ૨૧. અને તેમના મનપસંદ ફળો (તે યુવકો લઈને ફરતા) હશે.
 ૨૨. અને તેમના મનપસંદ પક્ષીનું માંસ (યુવકો લઈને ફરતા) હશે.
 ૨૩. અને (તેમના માટે) મોટા સુંદર નયનોવાળી ઢૂરો (પાંજી) હશે.
 ૨૪. જાણે સંભાળથી સાચવેલા મોતી હોય.
 ૨૫. આ સર્વ તેમની કરણીઓના બદલા તરીકે મળશે.
 ૨૬. ત્યાં તેઓ નિરર્થક અથવા ગુનાહની વાતો નહિ સાંભળે
 ૨૭. માત્ર 'સલામતી થાઓ, સલામતી થાઓ, નાજ શબ્દો (સંભળાતા) હશે.'
 ૨૮. અને જે જમણી તરફવાળા છે-તે કેવા (નસીબદાર) છે. જમણી તરફવાળા —
 ૨૯. કાંટા રહિત બોરડીઓ વચ્ચે હશે.
 ૩૦. અને ભરચક લૂમખાઓવાળી કેળોમાં,
 ૩૧. અને પથરાએલી શીતલ છાયા (નીચે)
 ૩૨. અને વહેતાં નિર્મળ પાણી (વચ્ચે)
 ૩૩. અને પુષ્કળ ફળો, (વચ્ચે રહેશે),
 ૩૪. જે (કદાપિ) ખૂટશે નહિ અને ન (ખાવામાં) તેમને શેકટોક થશે,
 ૩૫. અને તેમના પાકીઝાસાથી (હશે),

وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ ﴿١٥﴾
 عَلَى سُرُرٍ مَّوْضُونَةٍ ﴿١٦﴾
 مُتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ ﴿١٧﴾
 يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ ﴿١٨﴾
 بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ ﴿١٩﴾
 لَا يَصُدُّونَ عَنْهَا وَلَا يُنْزِفُونَ ﴿٢٠﴾
 وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرونَ ﴿٢١﴾
 وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ ﴿٢٢﴾
 وَحُورٌ عِينٌ ﴿٢٣﴾
 كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ ﴿٢٤﴾
 جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ﴿٢٥﴾
 لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا ﴿٢٦﴾
 إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا ﴿٢٧﴾
 وَأَصْحَابُ الْيَمِينِ هَٰذَا أَصْحَابُ الْيَمِينِ ﴿٢٨﴾
 فِي سِدْرٍ مَّخْضُودٍ ﴿٢٩﴾
 وَطَلْحٍ مَّنضُودٍ ﴿٣٠﴾
 وَظِلٍّ مَّمْدُودٍ ﴿٣١﴾
 وَمَاءٍ مَّسْكُوبٍ ﴿٣٢﴾
 وَفَاكِهَةٍ كَثِيرَةٍ ﴿٣٣﴾
 لَا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ ﴿٣٤﴾
 وَفُرُشٍ مَّرْفُوعَةٍ ﴿٣٥﴾

૩૬. જે અમે એક ઉમદા સર્જન કર્યું છે.

૩૭. જેને અમે તેમને માટે કુંવારીઓ બનાવી દીધી છે,

૩૮. તે સ્નેહાળ (યુવતીઓ) સમાન વયની હશે,

૩૯. જે જમણી તરફવાળાઓ સાથે હશે,

(રુકૂઅ-૧)

૪૦. જેની મોટી સંખ્યા પહેલા (ઈમાન) વાળાઓની છે.

૪૧. અને એક મોટી સંખ્યા બાદમાં ઈમાન લાવાનારામાંથી છે.

૪૨. પરંતુ જે ડાબી તરફવાળા છે તે કેટલા (બદનસીબ) છે. આ ડાબી તરફવાળા—

૪૩. દઝાડનારી લૂ તથા ઊકળતા પાણી વચ્ચે હશે,

૪૪. અને કાળા ધૂમાડાની છાયામાં હશે,

૪૫. જેમાં ન ઠંડક હશે ન રાહત હશે.

૪૬. આ પહેલાં તેઓ દુનિયામાં મોજ ઉડાવતા રહ્યા હતા.

૪૭. અને ગંભીર^(૬) ગુનાહોમાં રચ્યા પચ્યા રહેતા.

૪૮. અને કહેતા, 'શું અમે મરણ પામી માટી તથા હાડકામાં ફેરવાઈ જશું તો ફરી પાછા સજીવન કરવામાં આવશું?

૪૯. 'અને અમારા બાપદાદાઓને પણ (સજીવન થશે)?'

૫૦. તું કહે '(બેશક તમારા) આગલાઓ અને (તમારા) પાછલાઓ પણ,

إِنَّا أَنشَأْنَهُمْ إِنشَاءً ۝

فَجَعَلْنَهُمْ أَكْبَارًا ۝

عُرُبًا أَتْرَابًا ۝

لِلْأَصْحَابِ الْيَمِينِ ۝

ثَلَاثَةٌ مِنَ الْأَوَّلِينَ ۝

وثلثةٌ مِنَ الْآخِرِينَ ۝

وَأَصْحَابُ الشِّمَالِ ۚ مَا أَصْحَابُ الشِّمَالِ ۝

فِي سَوْمٍ وَحِيمٍ ۝

وَذَلِيلٍ مِّن يَّحْمُومٍ ۝

لَّا بَارِدٌ وَلَا كَرِيمٌ ۝

إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَلِكَ مُتْرَفِينَ ۝

وَكَانُوا يُصِرُّونَ عَلَى الْجَنِّتِ الْعَظِيمِ ۝

وَكَانُوا يَقُولُونَ ۚ أَيُّذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّ

عِظَامًا ۖ إِنَّا لَبَعُوثُونَ ۝

أَوِ آبَاؤُنَا الْأَوَّلُونَ ۝

قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ ۝

પ. જન્નતની ને 'મત્તા મોમિનોને આપવામાં આવશે જેમને અલ્લાહની કુરબત (નઝદિકી) હાંસલ થઈ હશે, જેમને સૂરાહ અલ રહમાનમાં 'અલસાબીકૂન'નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રુકૂઅમાં વણીયેલી જન્નત મોમિનો માટે રૂહાની સૂકુન (સંતોષ) તથા શાંતિ પ્રાપ્ત કરવાનું સ્થાન હશે, જ્યાં પાપ તથા ખદકારીઓનું અસ્તિત્વ નહિ હોય. કુરઆને મજીદમાં આ સ્થળને શાંતિ તથા સલામતીનું સ્થળ કહેવામાં આવ્યું છે; જે શાંતિ બક્ષનારો અલ્લાહજ છે.

દ. મૃત્યુ બાદ ફરી સજીવન થવાને માન્ય ન રાખવું, તે દુનિયામાં પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લેવું અને આખેરતનો ઈન્કાર છે. આ માન્યતા આ જીવનની તમામ ખૂરાઈઓનું જન્મસ્થાન છે. મૃત્યુ પછીના જીવનમાં ન માનનારા પોતાના પાપાચારોના ખૂરા પરિણામોની ગંભીરતાનો તથા ભલાઈમાંથી પ્રાપ્ત થનારા અનેક લાભો તથા સંતોષનો અંદાજ નથી કરી શકતા.

૫૧. 'એક મુકર્રર દિવસે, નક્કી સમયે (સૌને) એક જગ્યાએ એકઠા કરવામાં આવશે.

૫૨. 'હે ગુમરાહ થનારાઓ, હે (સત્યનો) ઈન્કાર કરનારાઓ હવે,

૫૩. 'બેશક તમે કાંટાળો તોર ખાશો,

૫૪. 'અને તેનાથી તમે તમારું પેટ ભરશો.

૫૫. 'અને ઉપરથી ઊકળતું પાણી પીશો.

૫૬. 'જેમ તરસ્યો ઊંટ પાણી પીધા પછી પણ અતૃપ્ત રહે તેમ (તમે અતૃપ્ત રહેશો).'

૫૭. ન્યાયના દિવસે તેમની આવી મહેમાન નવાઝી (અતિથી સન્કાર) થશે. (૭)

૫૮. જ્યારે અમેજ તેમને પેદા કર્યા છે, તો તમે શા માટે (આ સત્યનો) સ્વીકાર નથી કરતા?

૫૯. તમે જે વીર્ય (ગર્ભમાં) પાડો છો તેના વિશે તમે શું ધારો છો?

૬૦. શું તે (જીવનું) સર્જન તમારું કરેલું છે કે

અમે (તેના) સર્જનહાર છીએ?

૬૧. અમે તમારું (સૌનું) મૃત્યુ નિમાણું કર્યું છે. અને અમને કોઈ નીલ અટકાવી શકે,

૬૨. કે અમે તમારા સ્થાને બીજાને પેદા કરીએ, અને તેમને એવું રૂપ આપીએ છીએ કે જેનાથી તમે અજ્ઞાન છો?

૬૩. અને તમે પહેલી પેદાશથી વાકેફ છો છતાં કેમ કંઈ સમજતા નથી?

૬૪. તમે જે કંઈ વાવો છો તેના વિશે (કંઈ) જાણો છો?

لَجْجُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ ﴿٥١﴾

ثُمَّ إِنَّكُمْ إِلَيْهَا لَآتُونَ الْمَكْدُوبُونَ ﴿٥٢﴾

لَا كَلُونَ مِنْ شَجَرٍ مِنْ زُقُومٍ ﴿٥٣﴾

فَبَاكُونَ مِنْهَا الْبُطُونَ ﴿٥٤﴾

فَشَرِبُونَ عَلَيْهِ مِنَ الْحَيِّمِ ﴿٥٥﴾

فَشَرِبُونَ شُرْبَ الْهَيْمِ ﴿٥٦﴾

هَذَا نُزْلُهُمْ يَوْمَ الدِّينِ ﴿٥٧﴾

نَحْنُ خَلَقْكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ ﴿٥٨﴾

أَفَرَأَيْتُمْ مَا تُلْقُونَ ﴿٥٩﴾

وَأَنْتُمْ تَخْلُقُونَهُ أَمْ نَحْنُ الْخَالِقُونَ ﴿٦٠﴾

نَحْنُ قَدَرْنَا بَيْنَكُمْ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ﴿٦١﴾

عَلَىٰ أَنْ تُبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِي مَا

لَا تَعْلَمُونَ ﴿٦٢﴾

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَتَذَكَّرُونَ ﴿٦٣﴾

أَفَرَأَيْتُمْ مَا تَحْرُثُونَ ﴿٦٤﴾

૭. ગુનાહગારોની સજા કેટલી દર્દનાક હશે તેનો ચિતાર આ આયતોથી સહેજ મળી રહે છે. માટે પ્રત્યેક જીવે આ દુનિયાની મોહમાયાથી અનૃપ્ત રહેનારા પોતાના જીવન ઉપર ચિંતન કરવું જોઈએ અને પોતાના વિચારો, વાણી તથા વર્તન ઉપર કાબુ રાખવો જોઈએ.

૮. ઈન્સાનના સ્થાને બીજા સર્જનની સ્થાપનાનો અર્થ તે જીવનો અંત લાવવાનો નથી. મૃત્યુ વડે તો માત્ર ઈન્સાનનું રૂપ અથવા તેની સ્થિતિ બદલવામાં આવે છે. પાથિવ શરીરમાંથી મુકિત મેળવ્યા પછી તે જીવને બીજું શરીર આપવામાં આવે છે, જે શરીર તે જીવની કરેલી કરણીના ભલા બૂરા અંજમના અસરરૂપ પદાર્થથી અથવા તત્ત્વોથી બનેલો હોય છે. જે અવારનવાર કરવામાં આવતી નેકી અથવા બદીની પ્રગતિશીલ અસરોથી સુધરતો કે બગડતો રહે છે. સારાંશે તે શરીરના સારાનરસા વિકાસનો આધાર તેના આમાલો ઉપર હોય છે. આ પરિવર્તિત વિકાસ ક્રિયા ઈન્સાનની બેખબરીની હાલતમાં થતી રહે છે. જેનો તેને આ જીવનમાં આભાસ થતોજ નથી. જેથી જીવ પોતાની કિંતરત પ્રમાણે પોતાની કરણીઓમાં અભાન હાલતમાં પ્રવૃત્ત રહે છે.

૬૫. શું તમે તે ઊગાડો છો, કે અમે તેને ઊગાડનારા છીએ?

૬૬. જો અમે ચાહિયે તો તેનો ભૂકો કરી નાખીએ કે તમે વિલાપ કરતા કહો,

૬૭. 'અમે તો બરબાદ થઈ ગયા,

૬૮. 'બલ્કે, અમે તો બધું ગુમાવી દીધું?'

૬૯. શું જે પાણી તમે પીવો છો તેનો વિચાર કદીપણ તમે કર્યો છે?

૭૦. શું વાદળાઓમાંથી તે પાણી તમે વરસાવો છો, કે અમે તે વરસાવીએ છીએ?

૭૧. જો અમે ચાહતા હોત તો તેને કડવું કરી નાખત, છતાં શા માટે તમે શુક્રગુઝાર (બંદા) નથી બનતા?

૭૨. શું તમે જે આગ^(૯) જલાવો છો તેનો વિચાર કદીપણ તમે કર્યો છે?

૭૩. શું તે (બળતણના) ઝાડ તમે ઉત્પન્ન કર્યા છે, કે તેના ઉત્પન્ન કરનારા અમે છીએ?

૭૪. અમે તેને (જહન્નમની) યાદ અપાવનારી અને મુસાફરો માટે લાભદાયક બનાવી છે.

૭૫. માટે તું તારા ભૂલંદ શાનવાળા પરવરદિગારની તસ્બીહ (જપ) કર. (રુકૂઅ ૨)

૭૬. બલ્કે કસમ છે ખરતા^(૧૦) તારાની.

૭૭. અને ખરેજ, આ કસમ બહુજ ભારે છે, જો તમે એટલું જાણતા હો તો,

૭૮. કે આ કુરઆન ખરેખર આદરણીય છે,

૭૯. (જે) એક સુરક્ષિત કિતાબમાં લખાયેલું છે,

૮૦. જેના સુધી કોઈ નથી પહોંચતું સિવાય કે જેમને પાકીઝબી^(૧૧) અર્પણ કરવામાં આવી હોય.

ءَآتُمْ تَزْعَوْنَهُ اَمْ خُنَّ الرَّعْوَنَ ۝

لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفْلَهُونَ ۝

اِنَّا لَنَعْرَصُونَ ۝

بَلْ نَحْنُ مَحْرُومُونَ ۝

اَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ ۝

ءَآتُمْ اَنْزَلْنَاهُ مِنَ السَّمَاءِ اَمْ خُنَّ الْمُنْزِلُونَ ۝

لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ ۝

اَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ ۝

ءَآتُمْ اَنْشَأْتُمْ شَجَرَهَا اَمْ خُنَّ الْمُنْشِئُونَ ۝

نَحْنُ جَعَلْنَاهَا تَذْكُرَةً وَفِتْنَةً لِّلْمُؤْمِنِينَ ۝

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ الْعَظِيمِ ۝

فَلَا أُقْسِمُ بِوَقِيعِ النُّجُومِ ۝

وَإِنَّهُ لَقَسَمٌ لَّا تَعْلَمُونَ عَظِيمٌ ۝

إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ ۝

فِي كِتَابٍ مَّكْنُونٍ ۝

لَّا يَسْمَعُ رِإًآً اَبْطَاهِرُونَ ۝

૯. આગ ઈન્સાનના જીવનમાં એક બહુજ અગત્યનો ભાગ અદા કરે છે, જેમ જીવનમાં તેનું ઘણું મહત્વ છે, તેમ વિનાશમાં પણ તેનું એટલું મહત્વ છે. વર્તમાન જીવનની પ્રત્યેક વસ્તુ 'મિકેનિકલ' હોવાથી તે આગ ઉપર નભે છે. દા.ત. હુન્નર ઉદ્યોગ, વેપાર, સફર વગેરે અનેક ક્ષેત્રોમાં આગ બેહદ જરૂરી વસ્તુ છે.

૧૦. કુદરતના અટલ નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ રસૂલ કે મુજદ્દિદ જાહેર થાય છે, ત્યારે તારાઓ ખરવાનું પ્રમાણ વધી જાય છે, આવુંજ આંહલરત સ.અ.સ.ના ઝમાનામાં થવા પામ્યું હતું કે તે સમયે તારાઓનું ખરવું એક સાધારણ વસ્તુ હતી.

૧૧. પરહેઝગારી દ્વારા પોતાના અંતઃકરણને શુદ્ધ કરનારા નસીબદાર લોકોનેજ કુરઆનની આંતર દ્રષ્ટિની અને તેના મેહકુમ (તાત્પર્ય)ની સમજણ હોય છે. કુરઆનના રહાની તત્ત્વો તથા ઊંડા ઈલ્મ સુધી

૮૧. તમામ જહાનના પરવરદિગાર તરફથી તે તે ઊતારવામાં આવ્યું છે.

૮૨. છતાં તેમ અલ્લાહના કલામનો અસ્વીકાર કરે છે?

૮૩. અને તેના ઈન્કારને તમારા રીઝકનું (૧૨) સાધન બનાવે છે?

૮૪. પછી જ્યારે જીવ (મરનારના) ગળા સુધી આવી પહોંચે છે.

૮૫. ત્યારે તમે (હતાશાથી કાટી આંખે) જોઈ રહ્યા હો છો.

૮૬. અને (તે વખતે) તમારાથી વધુ અમે તેની નજીકમાં હોઈએ છીએ પરંતુ તમને તે દેખાતું નથી!

૮૭. અને જો (કર્મનો) હિસાબ દેવા માટે તમે કોઈથી બંધાયેલા નથી.

૮૮. (અને) જો તમે સાચા છો તો, શા માટે તે (જીવ)ને પાછો નથી લાવી શકતા?

૮૯. જો તે મુકર્રબ (અલ્લાહની નજીક પામેલા) લોકોમાંથી હશે,

૯૦. તો તેના માટે આરામ તથા (સુખોથી) મહેકતી ને'મતોવાળી જન્નત હશે.

૯૧. અને જો તે જમણી તરફવાળાઓમાંથી છે.

૯૨. (તો તેને કહેવામાં આવશે) 'તારા ઉપર સલામતી થાઓ (કે તું) જમણી તરફવાળા લોકોમાંથી છે.'

૯૩. પરંતુ જો તે તેમનામાંથી છે જે (સત્યને) જૂઠું કહેનારા છે અને ગુમરાહ થનારા છે,

૯૪. તો, ઊકળના પાણીથી તેનું સ્વાગત કરવામાં આવશે,

૯૫. અને જહનનમની જલનથી.

૯૬. બેશક આ જ સત્ય હકીકત છે.

૯૭. માટે તું તારા પાલનહારની તસ્બીહ (જપ) કર, જે સર્વોચ્ચતમ (૧૩) છે. (રૂકૂઅ-૩)

تَنْزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ﴿١١﴾

فِي هَذَا الْحَدِيثِ أَنْتُمْ مُدْهِنُونَ ﴿١٢﴾

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنْتُمْ تُكْذِبُونَ ﴿١٣﴾

فَلَوْلَا إِذَا بَلَغَتِ الْحُقُومَ ﴿١٤﴾

وَأَنْتُمْ حِينِيذٍ تَنْظُرُونَ ﴿١٥﴾

وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْكُمْ وَلَكِنْ لَا بُدَّ لَهُ مِنْ أَنْ يَأْتِيَهُمُ يَوْمَهُمُ الَّذِي كَانُوا يُوعَدُونَ ﴿١٦﴾

فَلَوْلَا إِنْ كُنْتُمْ غَيْرَ مَدِينِينَ ﴿١٧﴾

تَرْجِعُونَهَا إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿١٨﴾

فَأَمَّا إِنْ كَانَ مِنَ الْمُقَرَّبِينَ ﴿١٩﴾

فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتْ نَعِيمٌ ﴿٢٠﴾

وَأَمَّا إِنْ كَانَ مِنَ أَصْحَابِ الْيَمِينِ ﴿٢١﴾

فَسَلَمٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ﴿٢٢﴾

وَأَمَّا إِنْ كَانَ مِنَ الْكَاذِبِينَ الضَّالِّينَ ﴿٢٣﴾

فَنَزَّلُ مِنَ حَيْثُمْ ﴿٢٤﴾

وَتَصْلِيَةٌ جَمِيمٌ ﴿٢٥﴾

إِنَّ هَذَا لَهُوَ حَقُّ الْيَقِينِ ﴿٢٦﴾

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ الْعَظِيمِ ﴿٢٧﴾

નાપાક માનસ ધરાવનારા નથી પહોંચી શકતા. સાહજિક રીતે નાપાકીની હાલતમાં કુસ્આને મજદને સ્પર્શ ન કરવો જોઈએ.

૧૨. ઈન્કાર કરનારાઓને કુસ્આન ઉપર ઈમાન લાવાવાથી પોતાના જીવનનિર્વાહનું સાધન ગુમાવી દેવાની બીક રહે છે.

૧૩. 'સર્વોચ્ચતમ' - સર્વથી ઉચ્ચતર, તેમજ સર્વથી ઉત્તમતર, બૂલંદ શાનવાળો.